

ગુજરાત સરકાર



અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર

મહારાજા સયાજીરાવ ગાયકવાડ દલિત સાહિત્ય પ્રકાશન યોજના હેઠળ અનુ.જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે નાણાંકીય સહાય મેળવવા માટેનું અરજી પત્રક

- (૧) અરજદારનું નામ (અટક પહેલા લખવી) :-
- (૨) અરજદારનું પુરેપુરું સરનામું :-
(ફોન નં.મોબાઈલ નંબર અવશ્ય લખવો.)
- (૩) અરજદારનું કાયમી સરનામું. :-
- (૪) અરજદારની જાતિ :-
(સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ અનુ.જાતિના જાતિ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ જોડવી.)
- (૫) સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ કેટલા સમયથી કરો છો. :-
- (૬) (અ) આ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં સહાય મેળવવા અરજી કરેલ હોય તો તેની વિગત :-
- (બ) સહાય મળેલ હોય તો તેની વિગત :-
- (૭) કેવા પ્રકારનું સાહિત્ય પ્રસિધ્ધ કરવા માંગો છો ? તેની ટુંકી વિગતો
- નોંધ:- આપ જે કૃતિ/પુસ્તક પ્રકાશિત કરવા માંગતા હોય તેની હસ્તપ્રત અરજી સાથે અચુક મોકલવાની રહેશે.
- (૮) કયા પ્રકાશન દ્વારા પ્રસિધ્ધ કરવાના છે ? :-
- (૯) પ્રકાશન પાછળ અંદાજે કેટલો ખર્ચ થનાર છે. :-
કૃતિ/પુસ્તક કેટલા સમય સુધીમાં પ્રસિધ્ધ થશે. :-
- (૧૦)

અરજદારનો
પાસપોર્ટ
સાઇઝનો રંગીન
ફોટો

ક્રમ	વર્ષ:	કૃતિનું નામ
૧		
૨		
૩		

ક્રમ	વર્ષ:	કૃતિનું નામ	સહાયની રકમ રૂ.
૧			
૨			
૩			

સ્થળ:-

તારીખ:-

મહારાજા સયાજીરાવ દલિત સાહિત્ય પ્રકાશન સહાય યોજના અન્વયે અનુ.જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી. ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે નાણાંકીય સહાય આપવા અંગેના નિયમો

સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૨/૫/૨૦૦૨ના ઠરાવ ક્રમાંક: એસસીડબલ્યું/૧૦૦૧/ ન.બા.૧૪/ગ, (૨) ઠરાવ ક્રમાંક: એસ.સી.ડબલ્યું/૧૦૦૧/ન.બા.૧૪/ગ, તા.૧૭/૭/૨૦૦૮ થી અનુસૂચિત જાતિના સાહિત્યકારો, સર્જકો, સંશોધકો, અને પી.એચ.ડી ધારકોને તેમના લખાણો પ્રસિધ્ધ કરવા માટે રૂ.૧૦,૦૦૦/- (રૂપિયા દશ હજાર પુરા) સુધીની સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના અંગેની શરતો નીચે મુજબ છે.

- (૧) અનુ.જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે જ સહાય મળવા પાત્ર રહેશે.
- (૨) આ સહાય કેવળ મોલિક લખાણો માટે જ મળી શકશે. અન્ય કોઈપણ અનુવાદ માટે કે અગાઉ કોઈપણ જગ્યાએ પ્રસિધ્ધ થયેલ લખાણોના સંકલન માટે સહાય મળી શકશે નહીં.
- (૩) શરતો:-**
 - (ક) સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત માટે વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/- (રૂપિયા દશ હજાર)ની મર્યાદામાં હસ્તપ્રતની ૫૦૦ નકલોના મુદ્રણ અંગે કરેલા ખરેખર ખર્ચના ૭૫ ટકા સહાય આપવામાં આવશે. પરંતુ કોઈ પણ કિસ્સામાં સહાયની રકમ રૂ.૧૦,૦૦૦/- (અંકે રૂપિયા દશ હજાર) થી વધશે નહીં. મંજુર કરાયેલ સહાયની રકમમાંથી કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્રણ અંગેના વાઉચર નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને રજુ કરવાના રહેશે.
 - (ખ) પ્રગટ કરેલી નકલોની સંખ્યા ૫૦૦ કરતાં ઓછી હોવી જોઈશે નહીં.
 - (ગ) પ્રગટ કૃતિની ૧૫ નકલો વિના મુલ્યે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાની રહેશે.
 - (ઘ) “સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારની નાણાંકીય સહાયથી પ્રકાશિત કર્યું”તેવી ઋણ સ્વીકારની પંક્તિ અંદરના મુખ પૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છપાવવાની રહેશે.
 - (ચ) પ્રગટ થતી કૃતિમાં કોઈ જાહેરાત કે કોઈ પ્રકારનો વેપાર વિષયક સંદેશો લઈ શકાશે નહીં તેમજ કોઈ વિવાદ ઉભો થાય કે સુરૂચિનો ભંગ થાય તેવું કે સરકારે પ્રતિબંધિત કર્યાં હોય તેવા શબ્દો પ્રયોજીત કરી શકાશે નહીં.
 - (છ) આ યોજના હેઠળ સહાય મંજુર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની પૂર્વ મંજુરી સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં.
 - (જ) હસ્તપ્રત મંજુરીના હુકમની તારીખથી એક વર્ષમાં કૃતિ/પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. સમય મર્યાદામાં કૃતિ/પુસ્તક પ્રગટ નહીં કરનારની સહાય આપો આપ રદ થયેલી ગણાશે. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને પોતાને એમ કરવું જરૂરી જણાય તો સહાય મંજુર કરતા હુકમ હેઠળ ઉપર જણાવેલી શરતો ઉપરાંત બીજી શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકશે.
 - (ઝ) હસ્તપ્રતની જોડણી સરકાર માન્ય ગુજરાત વિદ્યાપીઠની સાર્થ જોડણી કોશ પ્રમાણે રાખવાની રહેશે.
 - (ટ) મળેલ સહાયની રકમ અન્ય કોઈ ખાનગી પ્રકાશન કે સંસ્થાને તબદિલ કરી શકાશે નહીં તથા તે માટેની આર્થિક સહાય અન્યત્રથી મેળવી શકાશે નહીં.
 - (ઠ) પુસ્તકના પ્રકાશન બાદ તેમાંના લખાણ સંબંધે કોઈપણ વિવાદ કે કાનૂની પ્રશ્નો ઉભા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લેખકની રહેશે.
 - (ડ) આ યોજના હેઠળ અગાઉ અનુસૂચિત જાતિના જે લેખકો, સાહિત્યકારો, સંશોધકો, સર્જકો, અને પી.એચ.ડી ધારકોને લાભ મળેલ છે તેઓને બીજીવાર આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.

એકરાર નામુ

આથી હું શ્રી.....મુ.....

તા.....જિલ્લો.....ઉ.વર્ષ.....તે આથી લેખિત બાંહેધરી આપું છું કે સરકારશ્રીના તારીખ.૨૨/૫/૨૦૦૨ના ઠરાવ ક્રમાંક: એસસીડબલ્યુ/૧૦૦૧/ન.બા.૧૪/ગ, થી અમલમાં મુકવામાં આવેલ અનુસૂચિત જાતિના લેખકો, સાહિત્યકારો અને પી.એચ.ડી ધારકોને તેમના સાહિત્યના પ્રકાશન માટે રૂ.૧૦,૦૦૦/- સુધીની સહાય આપવાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ દલિત સાહિત્ય પ્રકાશન યોજના અન્વયે નિયત કરવામાં આવેલ તમામ શરતો મેં કાળજી પૂર્વક વાંચેલ છે. અને તે મને કબુલ મંજુર છે તથા તમામ શરતો પરિપૂર્ણ કરવાની આથી હું ખાત્રી આપું છું. તથા અમોને આ યોજના હેઠળ સહાયની કોઈ રકમ આજદિન સુધી મળેલ નથી તેની પણ ખાત્રી આપવામાં આવે છે.

સ્થળ:-

તારીખ:-

અરજદારની સહી/-